

રાષ્ટ્રીય ગોકુલ મિશનક્ષેત્રે ગુજરાત રાજ્યની સિધ્ધિ

પશુપાલકોને દેશી નસ્લના પશુઓ રાખવા પ્રોત્સાહિત કરવા અને સાથે સાથે પશુઓનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા રાષ્ટ્રીય ગોકુલ મીશન અંતર્ગત ગોપાલ રત્ન એવોર્ડ: (દેશી નસ્લના ઉત્તમ પશુઓ રાખી પશુપાલન કરતા પશુપાલકો માટે) તથા કામઘેનુ એવોર્ડ: (દેશી નસ્લના ઉત્તમ પશુઓના સંવર્ધન અને જાળવણીની કામગીરી કરતી સંસ્થાઓ/ ટ્રસ્ટ/ એન.જી.ઓ./ ગૌશાળા/ બ્રીડર સોસાયટીઓ માટે) આપવાની શરૂઆત કરેલ છે.

આ યોજનાની માર્ગદર્શિકા અનુસાર દેશના અલગ અલગ પાંચ વિભાગો અનુસાર એવોર્ડ વિતરણ કરવામાં આવે છે, જેમાં ગુજરાત રાજ્યનો સમાવેશ પશ્ચિમ વિભાગમાં થાય છે. વધુમાં નેટીવ બ્રીડીંગ ટ્રેક અનુસાર ગુજરાત રાજ્યની ગાય વર્ગમાં ગીર તથા કાંકરેજ ગાયનો તથા ભેંસ વર્ગમાં મહેસાણી, સુરતી, જાફરાબાદી તથા બન્ની ભેંસનો સમાવેશ કરેલ છે. વર્ષ: ૨૦૧૮-૧૯ માટે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ-ગાંધીનગર દ્વારા પશુપાલન ખાતાની ક્ષેત્રિય કચેરીઓ મારફતે આ યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કરી અરજીઓ મેળવી તેને નિયત પદ્ધતિથી સ્ક્રીની કરી ગોપાલરત્ન એવોર્ડ માટે ૪(ચાર) તથા કામઘેનુ એવોર્ડ માટે ૪(ચાર) નોમીનેશન ભારત સરકારશ્રી દ્વારા નિયત કરેલ કમીટી દ્વારા પશુપાલન વ્યવસાયને લગતા વિવિધ પાસાઓ મુજબ મુલ્યાકન કરી તે અનુસાર માર્કસ આપી ભારત સરકારશ્રીને મોકલી આપેલ હતાં. ત્યારબાદ ભારત સરકારશ્રી દ્વારા એક્ષપર્ટ ઇન્સ્પેક્શન કમીટી નિયત કરી કમીટી દ્વારા નોમીનેટ કરાયેલ પશુપાલકો તથા સંસ્થાઓની મુલાકાત લઈ ભારત સરકારશ્રીને રીપોર્ટ કરેલ હતો. ત્યારબાદ ભારત સરકારશ્રી દ્વારા વિજેતા જાહેર કરેલ પશુપાલકો તથા સંસ્થાઓની વિગતો નીચે મુજબ છે

વર્ષ: ૨૦૧૮-૧૯

- ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા:

અ. નં.	વિજેતાનું નામ	જીલ્લો	બ્રીડનું નામ	ક્રમાંક	ઇનામની રકમ
૧	પિયુષભાઈ જશવંતભાઈ પટેલ	સુરત	ગીર ગાય, મહેસાણી ભેંસ	દ્વિતિય	રૂ. ૩.૦૦ લાખ
૨	વૈભવભાઈ બી. પટેલ	અમદાવાદ	ગીર ગાય	તૃતિય	રૂ. ૧.૦૦ લાખ

• કામઘેનુ ઁવોર્ડ વિજેતા:

અ.નં.	વિજેતાનું નામ	જીલ્લો	બ્રીડનું નામ	ક્રમાક	ઇનામની રકમ
૧	શ્રી પુરુષાર્થ ટ્રસ્ટ	સુરેન્દ્રનગર	ગીર ગાય	પ્રથમ	રૂ. ૫.૦૦ લાખ
૨	શ્રી સ્વામીનારાયણ ગૌશાળા	ગાંધીનગર	ગીર ગાય	દ્વિતિય	રૂ. ૩.૦૦ લાખ
૩	શ્રી હરિ સત્સંગ સેવા ટ્રસ્ટ- કુંડળ	બોટાદ	ગીર ગાય	તૃતિય	રૂ. ૧.૦૦ લાખ

આ યોજના હેઠળ વર્ષ: ૨૦૧૮-૧૯થી ભારત સરકારશ્રી દ્વારા અન્ય શ્રેણીઓ માટે પણ ઁવોર્ડની શરૂઆત કરાએલ હતી જેવા કે બેસ્ટ ફીલ્ડ વેટરનરીઅન ઁવોર્ડ, બેસ્ટ ઁ.આઇ.ટેકનીશીઅન ઁવોર્ડ, આર.જી.એમ બેસ્ટ પર્ફોર્મીંગ સ્ટેટ ઁવોર્ડ. આ પૈકી આર.જી.એમ બેસ્ટ પર્ફોર્મીંગ સ્ટેટ ઁવોર્ડમાં પશ્ચિમ વિભાગમાં ગુજરાત રાજ્ય દ્વિતિય ક્રમાંકે વિજેતા થયેલ છે તથા રૂ. ૨૧,૦૦૦/- નું ઇનામ પ્રાપ્ત થયેલ છે.

બેસ્ટ ઁ.આઇ.ટેકનીશીઅન ઁવોર્ડમાં પ્રથમ ક્રમાંકે ગુજરાત રાજ્યના ત્રણ ટેકનીશીયન વિજેતા થયેલ છે, જેની વિગતો નીચે મુજબ છે.

બેસ્ટ ઁ.આઇ ટેકનીશીયન ઁવોર્ડ વિજેતા:

અ.નં.	વિજેતાનું નામ	જીલ્લો	સંસ્થાનુ નામ	ક્રમાંક	ઇનામની રકમ
૧	શ્રી મૌલિકકુમાર પટેલ	મહેસાણા	ઘનિષ્ટ પશુ સુધારણા યોજના	પ્રથમ	રૂ. ૫૧૦૦૦.૦૦
૨	શ્રી રામચંદ્ર પટેલ	બનાસકાંઠા	ઘનિષ્ટ પશુ સુધારણા યોજના	પ્રથમ	
૩	શ્રી કાંતિભાઇ પ્રજાપતિ	અરવલ્લી	ઘનિષ્ટ પશુ સુધારણા યોજના	પ્રથમ	

આમ, આપના રાજ્યે અલગ અલગ કેટેગરીમાં મળી કુલ-૯ રાષ્ટ્રીય ગોકુલ મિશન ઁવોર્ડ મેળવીને સમગ્ર દેશમાં ડંકો વગાડેલ છે.; જે આપના સૌ માટે ગૌરવની બાબત

છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે ટીમ પશુપાલન સહીત રાજ્યના પશુપાલકો અને ગૌસંવર્ધન ક્ષેત્રે કાર્યરત તમામ અભિનંદનને પાત્ર છે.